

Ref: MIL/BSE/2021 Date: 13.11.2021

To,
The Corporate Relations department
Bombay Stock Exchange Limited
Department of Corporate Services
P J Towers, Dalal Street, Fort,
MUMBAI 400001

Re: Maximus International Limited

Script Code: 540401

Subject: Publication of Unaudited Standalone and Consolidated Financial Results of the

Company for the Second Quarter and Half Year ended on 30th September, 2021

Dear Sir/Madam,

Please find enclose herewith copies of the following newspapers cuttings wherein Unaudited Standalone and Consolidated Financial Results for the Second Quarter and Half Year ended on 30th September, 2021 are published.

- 1. Business Standard Ahmedabad Edition
- 2. Vadodara Samachar- Gujarati

Please find the above in order and take the same on your records.

Thanking you,

Yours faithfully,

FOR: MAXIMUS INTERNATIONAL LIMITED

Dharati Shah Company Secretary

Encl: as above

United Petro Finance Limited

(A part of The Investment Trust Of India Limited Group) wn, A Wing, Unit No 2003, 20th floor, Senapati Bapat Marg, Mumbai-400013 **GOLD AUCTION NOTICE**

The borrowers, in specific and the public, in general, are hereby notified that public auction of the gold ornaments pledged in the below accounts is proposed to be conducted at 1st Floor, Mahavir Apartment, on Above Swastik Police Statement, Near Moti Tanki Circle, Rajkot, Gujarat 360001 on 24/11/2021 from 10.00 am onwards.

The auction is of the gold ornaments of defaulted customers who have failed to make payment of their loan amount despite being notified by registered letters. Change in venue or date (if any) will be displayed at the auction centre and on the company website. Unauctioned items shall be auctioned on subsequent working days after displaying the details on Company website and auction centre

List of pledges to be auctioned on 24/11/2021 from 10.00 am onwards.

GL/BR13/001080	GL/BR12/002135	GL/BR13/001475	GL/BR13/001646
GL/BR11/001302	GL/BR11/001680	GL/BR12/001708	GL/BR12/001884
GL/BR12/001273	GL/BR13/001298	GL/BR17/000055	GL/BR13/001668
GL/BR13/001173	GL/BR11/001694	GL/BR13/001974	GL/BR11/002169
GL/BR12/001404	GL/BR11/001703	GL/BR11/002496	GL/BR13/001683
GL/BR11/001602	GL/BR13/001310	GL/BR11/002501	GL/BR11/002209
GL/BR12/001409	GL/BR13/001337	GL/BR17/000056	GL/BR13/001711
GL/BR11/001619	GL/BR12/001511	GL/BR13/001528	GL/BR13/001713
GL/BR12/001419	GL/BR11/001741	GL/BR12/001747	GL/BR12/001940
GL/BR13/001244	GL/BR11/001801	GL/BR12/001750	GL/BR12/001974
GL/BR12/001421	GL/BR13/001399	GL/BR12/001752	GL/BR12/001979
GL/BR12/001447	GL/BR17/000015	GL/BR17/000074	GL/BR12/001982
GL/BR11/001661	GL/BR13/001913	GL/BR11/002037	GL/BR12/002010
GL/BR11/001670	GL/BR17/000233	GL/BR17/000090	GL/BR17/000173
GL/BR11/001674	GL/BR13/001943	GL/BR13/001589	GL/BR12/002017
GL/BR12/001463	GL/BR13/001952	GL/BR12/001798	GL/BR11/002319
GL/BR11/001676	GL/BR11/002474	GL/BR12/001804	GL/BR12/002032
GL/BR12/002069	GL/BR13/001962	GL/BR11/002090	GL/BR13/001817
GL/BR17/000207	GL/BR11/002478	GL/BR13/001628	GL/BR13/001824
GL/BR13/001874	GL/BR13/001473	GL/BR11/002121	GL/BR17/000195

For more details please contact Mr.Dinesh Rathod- 98248 65970

Particulars

Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or

Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or

Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or

Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss)

for the period (after tax) and Other Comprehensive Income (after tax)

Total Income from Operations

Extraordinary items)

Extraordinary items)

Extraordinary items)

Paid up Equity Share Capital

discontinued operations) -

1. Basic

2. Dilute

Place: Mumbai

Date: November 12, 2021

Reserves (excluding Revaluation Reserve)

Earnings Per Share (of Rs.10/- each) (for continuing and

2

3

4

5

6

Note:

Authorized Officer For United Petro Finance Ltd(ITI Gold Loan)

केनरा बैंक 📣 Canara Bank

Premises and Estate Section, Circle Office, Ahmedabad Telephone No.: 079 69027787

REQUIREMENT OF SPACE FOR SHIFTING OF BRANCH Canara Bank required premises for the following branch on rental basis, prederably on Ground Floor, Strong room is to be constructed as per Bank's requirement by landlord.

11400		m rounds	AL GU
Subhanpura Vadodara		Vadodara	1500 - 2000 SFT APPROX
documents. Tenders are to 03.12.2021. f bank website	The Bid docum be submited a further Commur only. bank dea right to accept o	ents are to be it above office la nication and ame ils with landlord	hank.com for details of bid downloaded from our website. stest by 4.00 p.m. on or before andment, if any, will be posted in directly. Brokers excuse. Bank the offers without assigning any
Date : 13 11 2	2021		SD/-

DEPUTY GENERAL MANAGER, Ahmedabad Place : Gandhinagar

IDFC FIRST BANK LIMITED (erstwhile Capital First Limited) And Amalgamated With Idfc Bank Limited)

Cin : L65110tn2014plc097792

Registered Office: Krm Towers, 8th Floor, Harringtone Road, chetpet, Chenr Tel : +91 44 4564 4000 | Fax : +91 44 4564 4022

AUTHORIZED OFFICER – Satyendra Maurya CONTACT NUMBER- 8306001848
AUTHORIZED OFFICER – Debjyoti Roy CONTACT NUMBER- 9874702021 ROPERTY FOR SALE UNDER PROVISIONS SARFAESI ACT, 2002 BY PRIVATE TREAT

Whereas the Authorised Officer of IDFC FIRST Bank Ltd has taken the Possession u/s 13(4) of the Securitisation & Reconstruction of Financial Assets and Enforcement of Security interest Act, 2002 (The SARFAESI Act, 2002) of the property being Block No. A/3-302 (B4/302), Indiabulls Centrum, Nr. Haribhai Godani Hospital, Saraspur, Ahmedabad, Gujarat-380018. ("the Secured Asset" with respect to Loan Account No.14439760 of (1) Bhanubhai Danaji Mali, (2) Hansaben Bhanubhai Mali (Borrowers). The Authorised Officer has received an expression of interest from a prospective purchaser towards purchase of the above mentioned Secured Asset under the SARFAESI Act. Now, the Authorised Officer is hereby giving the Notice to Sale of the aforesaid property by Private Treaty in terms of rule 8 and 9 of the Security Interest (Enforcement) Rules 2002. The Sale will be on "AS IS WHERE IS BASIS and AS IS WHAT IS BASIS".

The Date of Sale under Private Treaty is fixed for 30.11.2021 and the Reserve Price fixed for the sale is Rs. 11,00,000/- (Rupees Eleven Lakhs Only).

The Borrower and Co Borrower are hereby notified to pay the sum as mentioned in the demand notice i.e Rs. 20,24,848.34 /- along with interest and ancillary expenses before 30.11.2021, failing which the property will be sold by Private Treaty.

Date: 12-11-2021 **Authorised Officer** IDFC FIRST BANK LIMITED Place : Surat

30.09.2021 | 30.06.2021 | 30.09.2020 | 30.09.2021 | 30.09.2020 | 31.03.2021

(Unaudited)

4455.84

853.20

853.20

625.20

2061.56

357.26

17.50

(Unaudited)

1838.14

317.84

317.84

191.84

-395.91

357.26

5.37

(Rs. in Lacs) (Except Figures in EPS)

(Unaudited)

4167.14

891.64

891.64

718.64

1423.92

357.26

20.12

For and on behalf of the Board of Directors of

Coral Laboratories Limited

Sushma Kadkade

Director & CFO

(DIN:07791735)

Year Ended

(Audited)

10033.73

1759.37

1761.25

1355.46

2097.25

357.26

37.94

13307.07

Half Year Ended

CORAL LABORATORIES LIMITED

Corp Office: 3/B Patanwala Compound, Opp. Shreyas Cinema, L.B.S. Marg, Ghatkopar (W), Mumbai, Maharashtra – 400 086.

Registered Office: SF-206, Silver Oak Complex, B.P. C. Road, Vadodara, Gujarat - 390020

Tel: 022-2500 5245 | Email: cs@corallab.com | Website: www.corallab.com

CIN: L24231GJ1997PLC031669

Quarter Ended

(Unaudited)

2529.08

719.36

719.36

580.36

2270.78

357.26

16.24

Extract of Unaudited Standalone Financial Results for the Quarter and Half Year Ended 30th September, 2021

(Unaudited)

1926.77

133.84

133.84

44.84

-209.22

357.26

1.26

MAXIMUS INTERNATIONAL LIMIT

Regd. Office: 504A, 5th Floor "OZONE" Dr. Vikram Sarabhai Marg. Vadi-Wadi, Vadodara - 390003. CIN: L51900GJ2015PLC085474



EXTRACT OF STATEMENT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE OUARTER AND HALF YEAR ENDED 30TH SEPTEMBER, 2021

	THE QUARTER AND HA	ALF TEAR ENDED SOTH SEPTEMBER, 2021							
		Consolidated (₹ in Lakhs							
Sr.	Particulars	G	uarter Ende	d	Half Yea	Year Ended			
No.	Particulars	30.09.2021 (Unaudited)	30.06.2021 (Unaudited)	30.09.2020 (Unaudited)	30.09.2021 (Unaudited)	30.09.2020 (Unaudited)	31.03.2021 (Audited)		
1	Total Income from operations (Net)	1,573.70	1,971.11	1,407.52	3,544.82	2,635.72	5,312.02		
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	134.09	116.41	162.20	250.50	249.68	395.14		
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	134.09	116.41	162.20	250.50	249.68	395.14		
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	117.68	108.57	148.20	226.25	218.57	353.22		
5	Total Comprehensive Income for the period	116.78	160.64	163.70	277.42	213.15	233.73		
6	Equity Share Capital (Face Value Rs.10/- per share)	1,257.20	1,257.20	1,257.20	1,257.20	1,257.20	1,257.20		
7	Other Equity (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	-	-	864.2		
8	Earnings Per Equity Share on net profit after tax (Fully paid- up equity share of Rs. 10/- each)								
	Basic:	0.84	0.80	1.07	1.64	1.49	2.48		
	Diluted:	0.84	0.80	1.07	1.64	1.49	2.48		

FC FIRST

. Key numbers of Unaudited Standalone Financial Results

			(₹ in Lakhs)				
Sr.		G	uarter Ende	d	Half Yea	Year Ended	
No.		30.09.2021	30.06.2021	30.09.2020	30.09.2021	30.09.2020	31.03.2021
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
1	Turnover (Revenue from operations)	115.80	249.81	130.61	365.62	227.65	470.18
2	Profit Before Tax	6.62	1.63	17.84	8.25	33.20	39.10
3	Profit After Tax	3.62	0.52	12.87	4.14	24.02	24.40

(In above table, brackets denotes negative figures)

2. The above is an extract of the Unaudited Financial Results filed with the Stock Exchange. The detailed Financial Results are available on the Company's website at www.maximusinternational.in and the Stock Exchange's Website at www.bseindia.com.

For Maximus International Limited

Deepak V Raval Place: Vadodara (Chairman & Managing Director) Date: 12th November, 2021

OPTIMUS FINANCE LIMITED

OPTIMUS

Regd. Office: 504A, 5th Floor "OZONE" Dr. Vikram Sarabhai Marg, Vadi-Wadi, Vadodara - 390003. CIN: L65910GJ1991PLC015044

EXTRACT OF STATEMENT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30TH SEPTEMBER, 2021

(₹ in Lakhs) Consolidated Year Ended **Quarter Ended Half Year Ended** Sr. **Particulars** 30.09.2021 30.06.2021 30.09.2020 30.09.2021 30.09.2020 No. 31.03.2021 (Audited) (Unaudited) (Unaudited) (Unaudited) (Unaudited) (Unaudited) 5402.33 1422.22 2665.46 1 Total Income from operations (Net) 1585.12 1982.81 3567.93 Net Profit / (Loss) for the period 248.30 399.22 2 114.65 161.61 246.35 131.70 (before Tax, Exceptional and/or Extraordinary items) Net Profit / (Loss) for the period before tax 131.70 114.65 161.61 246.35 248.30 399.22 (after Exceptional and/or Extraordinary items) Net Profit / (Loss) for the period after tax 115.17 106.91 147.27 222.08 216.94 355.84 (after Exceptional and/or Extraordinary items) 158.99 162.77 273.25 236.34 5 Total Comprehensive Income for the period 114.27 211.52 557.23 557.23 557.23 557.23 557.23 557.23 6 Equity Share Capital (Face Value Rs.10/- per share) Other Equity (excluding Revaluation Reserve) as shown 1085.91 in the Audited Balance Sheet of the previous year Earnings Per Equity Share on net profit after tax 8 (Fully paid- up equity share of Rs. 10/- each) 1.12 2.11 Basic: 1.16 1.52 2.28 3.60 1.52 Diluted: 1.16 1.12 2.28 2.11 3.60

Notes: 1. Key numbers of Unaudited Standalone Financial Results

			(₹ in Lakhs)				
S	Particulare	G	uarter Ende	d	Half Yea	Year Ended	
N		30.09.2021	30.06.2021	30.09.2020	30.09.2021	30.09.2020	31.03.2021
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
	Turnover (Revenue from operations)	11.91	11.88	15.14	23.79	30.61	90.41
2	Profit Before Tax	(2.39)	(1.76)	(0.60)	(4.14)	(1.38)	4.08
- (Profit After Tax	(2.50)	(1.66)	(0.95)	(4.16)	(1.63)	2.62
(In above table, brackets denotes negative figures)							

2. The above is an extract of the Unaudited Financial Results filed with the Stock Exchange. The detailed Financial Results are available on the Company's website at www.optimusfinance.in and the Stock Exchange's Website at www.bseindia.com.

For Optimus Finance Limited Deepak V Raval

IDFC FIRST

(Wholetime Director & Company Secretary) Date: 12th November, 2021

YUVRAAJ HYGIENE PRODUCTS LIMITED

a) The above is an extract of the detailed Unaudited Financial Results for the Quarter and Half Year Ended, September 30, 2021 filed with the BSE Limited under Regulation 33 of

the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Half Year Ended Unaudited Financial Results are available on the website of the BSE limited (www.bseindia.com) and the listed entity (www.corallab.com).

c) The above financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on November 12, 2021.

The Company has adopted Ind AS for the financial year commencing from 1st April, 2017 and above results have been prepared in accordance with Ind AS, as prepared under section 133 of the Companies Act, 2013 read with Rule 3 of the Companies (Accounting Standards) Rule, 2015.

CIN: L74999MH1995PLC220253 Regd. Office: Plot no. A-650, TTC Industrial Estate, MIDC, Mahape, Pawane Village, Navi Mumbai - 400705. Tel: 022 27784491, Email ID: yhpl@hic.in, Website: www.hic.in

					Rs. in Lakhs	(Except EPS)
Sr. No.	Particulars	FOR THE QUARTER ENDED 30.09.2021 (Un-audited)	FOR THE QUARTER ENDED 30.09.2020 (Un-audited)	FOR THE SIX MONTHS ENDED 30.09.2021 (Un-audited)	FOR THE SIX MONTHS ENDED 30.09.2020 (Un-audited)	FOR THE YEAR ENDED 31.03.2021 (Audited)
1	Total income from operations	544.56	478.48	916.99	724.53	1,614.3
2	Net Profit / (Loss) for the period before					
	Tax, Exceptional and/or Extraordinary items	(9.59)	17.29	(36.99)	15.84	(41.36
3	Net Profit / (Loss) for the period before					
	tax after Exceptional and/or Extraordinary items	(9.59)	17.29	(36.99)	15.84	(41.36
4	Net Profit / (Loss) for the period after tax					
	(after Exceptional and/or Extraordinary items)	(6.83)	20.43	(31.51)	22.16	(32.40
5	Total Comprehensive Income for the period					
	[Comprising Profit / (Loss) for the period (after tax)					
	and other Comprehensive Income (after tax)]	(6.68)	20.37	(31.22)	22.05	(31.8
6	Paid-up equity share capital (Face Value of Re. 1/- each)	906.56	741.56	906.56	741.56	741.5
7	Reserves (excluding Revaluation Reserves as per					
	balance sheet of previous accounting year)	-	-	-	-	(1,113.93
8	Earnings Per Share (of Rs. 1/-each)					
	(for continuing and discontinued Operations)-					
	Basic:	(0.01)	0.03	(0.03)	0.03	(0.04
	Diluted:	(0.01)	0.03	(0.03)	0.03	(0.04

Note:

- a) The above is an extract of the detailed format of Quarterly and Half Yearly Un-audited Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the website of the Company (www.hic.in) and also on Stock Exchange website (www.bseindia.com).
- The Quarterly and Half Yearly Un-audited Financial Results have been reviewed by the Audit Committee of the Board and approved by the Board of Directors of the Company at its meeting held on Novermber 12, 2021. The Statutory Auditors of the Company have carried out a Limited Review of the

For Yuvraaj Hygiene Products Limited

Sd/-Vishal Kampani **Managing Director** Date: 12th November, 2021 DIN: 03335717

IDFC FIRST BANK LIMITED (erstwhile Capital First Limited) and amalgamated with IDFC Bank Limited)CIN: L65110TN2014PLC097792

Registered Office: KRM Towers, 8th Floor, Harringtone Road, Chetpet, Chennai-600031. TEL: +91 44 4564 4000 | FAX: +91 44 4564 4022

AUTHORIZED OFFICER – Satyendra Maurya CONTACT NUMBER- 8306001848 AUTHORIZED OFFICER – Debjyoti Roy CONTACT NUMBER- 9874702021

APPENDIX- IV-A [See proviso to rule 8 (6)] SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002 Notice is hereby given to the public in general and in particular to the Borrower (s) and Co-Borrower (s) as per column (ii) that the below described immovable properties as per column (iii) mortgaged/charged to the Secured Creditor, the symbolic possession of which has been taken by the Authorised Officer of erstwhile Capital First Home Finance Limited and Capital First Limited now IDFC FIRST Bank Limited, will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" on 30th November 2021 as described hereunder, for the recovery of amount due from Borrower (s) and Co-Borrower (s) as per column (i), due to IDFC FIRST Bank Limited (erstwhile Capital First Home Finance Limited and Capital First Limited).

	(i)	(ii)	(iii)	(iv)	(v)	(vi)
Sr. No	Demand Notice Amount & Date	Name Borrower (s) and Co-Borrower (s)	PROPERTY ADDRESS	Reserve Price Amount	EMD Amount	Date and Time of Auction
1	INR 9,98,073.48 As on 8th Feb 2019	Prince Mobile, Umeshkumar S Domdiya & Lilaben Shantibhai Dombadiya	All the Piece and Parcel of the property consisting of Flat No. E/503 5th Floor, Sakar Palace, Bldg No E Block No. 131, Opp Aradhna Row House, Nr. Millenium Park, Moje, Karadwa Surat - 394210	8,79,200	87,920	30 Nov 2021 11.00 AM to 1.00 PM
2	INR 73,90,147.25 As on 13-Feb-2019	Khodal Textiles, Harshaben Himmatbhai Navadia, Himatbhai Kanjibhai Patel, Abhishek H Navadiya & Ravi Himmatbhai Navadiya	Flat No. 1004, 10th Floor, C-Tower, Rajhans Tower, Mota Varachha, Surat-394101 & Flat No. 1003, 10th Floor, C- Tower, Rajhans Tower, Mota Varachha, Surat-394101	65,80,800	6,58,080	30 Nov 2021 11.00 AM to 1.00 PM
3	INR 67,18,790.99 11-Nov-2019	Krystal Tours and Travels, Firoza Nevil Gamit, Nevil Kiritbhai Gamit & Vanitaben Mohanbhai Gamit	Immovable Property, Plot No 8, "Prachin Nagar Co-Op Housing Society Ltd.", Developed upon land Situated in State: Gujarat, District: Surat, Sub-District & Taluka: Surat City, Moje: Adajan Bearing RevenueSurvey No. 259+260+261 Paikee, Final Plot No. 150 Admeasuring 3538.00 mtrs, Paikee	52,15,350	5,21,535	30 Nov 2021 11.00 AM to 1.00 PM
3	INR 72,91,010.22 30th Sep 2019	Krishna Mobile, Mr. Babubhai Jadavbhai Goyani & Mr. Jatinkumar Babubhai Goyani	The Property Bearing Plot No. I/40 admeasuring 62.22 sq. yard i.e. 40*14 feet i.e. 560 sq. fts. i.e. 52.93 sq. mts. & 140.09 sq. mts. Construction, in "Orovil Society", situate at Revenue Survey No. 74 Paiki, T.P. Scheme No. 6 (Khatodra-Majura), Final Plot No. 24(23) of Moje Village Majura, Surat, Gujarat - 395003	57,15,500	5,71,550	30 Nov 2021 11.00 AM to 1.00 PM

For detailed terms and conditions of the sale, please refer to the link provided in IDFC FIRST Bank website i.e. www.idfcfirstbank.com.

Authorised Officer IDFC FIRST Bank Limited Date: 12.11.2021 (Formerly known as Capital First Home Finance Limited/ Capital First Limited) Place : Surat

ગુજરાતની ૧૦ હજારથી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી સંભવત

(પ્રતિનિધિ)અમદાવાદ,તા.૧૨ આગામી ૨૦૨૨ના ડિસેમ્બરમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ પહેલા એટલે કે ડિસેમ્બર ૨૦૨૧માં રાજ્યની ૧૦,૩૧૫ જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. આ સાથે જ રાજ્યની આશરે ૧૦૦૦ જેટલી ગ્રામ પંચાયતોની પેટાચંટણી પણ યોજાશે.

ગ્રામ પંચાયતની ચંટણી અને પેટા ચૂંટણી સંભવતઃ ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં યોજાશે. અપૂરતા ઇવીએમના કારણે રાજ્ય ચૂંટણી પંચે આ ચૂંટણીઓ બેલેટ પેપેરથી કરવાની યોજના બનાવી છે.

રાજ્યના ચૂંટણી પંચે ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. નવેમ્બરના અંત સુધીમાં ચૂંટણી પંચ આની સત્તાવર જાહેરાત કરશે.

નોંધનીય બાબત એ છે કે, ગજરાત વિધાનસભા ૨૦૨૨ની સામાન્ય ચૂંટણી તેમજ ડિસેમ્બર મહિનામાં આવી રહેલી ૧૦,૩૧૫ જેટલી ગ્રામપંચાયતોની ચૂંટણીને ધયાનમા રાખી પટેલ સરકારે તડામાર તૈયારીઓ શરૂ કરી છે. તેના ભાગરૂપે મુખ્યત્વે રસીકરણ, કોરોનાની ત્રીજી લહેર, વિકાસ યોજનાઓ અને સરકારી કાર્યક્રમોની અમલવારી સહિત તમામ જિલ્લામાં સ્નેહ સંમેલનના કાયકમો રાજ્યસરકાર દ્વારા યોજવામાં આવી રહ્યા છે.

ગુજરાતની ડિસેમ્બર ૨૦૨૧ની ગ્રામ પંચાયતોની અને ડિસેમ્બર ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા કક્ષાએ સરકારી યોજનાઓનો નાગરિકોને વધુમાં વધુ લાભ મળતો થાય તે માટેનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે આજે ગુજરાતમાં લોકોના સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે માટે નિરામય ગુજરાતના નામથી નવી યોજનાનો શુભારંભ

મહત્વનું છે કે, ગ્રામ્ય કક્ષાના પ્રશ્નોના ઉકેલ, ગ્રામ્ય કક્ષાએ વહીવટી માળખું તથા વિકાસની જવાબદારી ગ્રામ પંચાયતની હોય છે. આ ઉપરાંત વિવિધ પ્રકારની યોજનાઓના લાભો ગ્રામય કક્ષાએ ગ્રામ પંચાયત મારફત આપવામાં આવે છે. જેવી કે, સંપૂર્ણ ગ્રામીણ સ્વરોજગાર યોજના, ખાસ રોજગાર યોજના, ઇન્દિરા આવાસ યોજના, ગ્રામીણ સ્વચ્છતા યોજના, ગોક્ળ ગ્રામ યોજના, સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના વગેરે. ગ્રામ પંચાયતમાં અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન ગ્રામસભા યોજવામાં આવે છે, જેમાં ગામને લગતાં પ્રશ્નોનો તાત્કાલિક અમલ કરવા ચર્ચા કરવામાં આવે છે.

ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન સહિત રાજ્યસરકાર દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણી સમરસ બને તે માટે તડામાર તૈયારીઓ આરંભી

પશ્ચિમ રેલ્વે KV AC OHE વિવિધ કામો

ીનીયર ડિવીઝન ઇલેક્ટ્રીક એન્જીનીયર (ટીઆરડી) ાલસાડ, નીચે આપેલી વિગતો મુજબ ઇ-ટેન્ડર નામંત્રીત કરે છે : ટેન્ડર સૂચના **નં.** અને તારીખ એલ-ટીઆરડી-ડબ્લ્યુ-૧૧૮-૨૧-૨૨-૧૬૦ તા : ૧૧.૧૧.૨૦૨૧, કામનું નામ ડીઝાઇન પુરવઠો, ૨x૨૫નું ઉત્થાન, પરીક્ષણ અને કમીશનર્ન ક્વી ઓએચઇ એસી વેસ્ટર્ન રેલવેના મુંબઇ ડીવીઝન ાર વિરાર–સુરત સેક્શન વચ્ચે ટ્રેનની ઝડપ વધારીને . ૬૦ કેએમપીએચ વર્ક (તબક્કો-II), જાહેરાત મૂલ્ય ા. ૯૭,૫૫,૧૨,૯૦૯/- કમાણી :શૂન્ય ાબમિશનની તારીખ અને સમય ૧૬.૧૨.૨૦૨૧ .પ.૦૦ કલાક ખોલવાની તારીખ અને સમ^ર . ૬.૧૨.૨૦૨૧ ૧૫.૩૦ કલાક કામની વિગતવાર પ્રકૃતિ જેમાં ટેન્ડર દસ્તાવેજની કિંમત (રિફંડપાર નથી) ઇએમડી પાત્રતા માપદંડો, કામની સમાન પ્રકૃતિ વિગતવાર ટેન્ડર શરતો, કૃપા કરીને vww.ireps.gov.inની મુલાકાત[ે]લો મેન્યુઅલ નોફર્સ ધ્યાનમાં લેવામાં આવશે **ન**હીં. લાઇક કરો f facebook.com/WesternRly

પશ્ચિમ રેલ્વે

ઇ-ઓકશન સેલ પ્રોગ્રામ મટીરીયલ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ માટે સુધારો વડોદરા ડિવિઝન ખાતે નવેમ્બર-૨૦૨૧માં ૧૭.૧૧.૨૦૨૧ના રોજ યોજાનાર ઇ-ઓકશન સેલ પ્રોગ્રામને ૨૨.૧૧.૨૦૨૧ના રોજ ફરીથી શેડયૂલ કરવામાં આવ્યો છે. અન્ય તમામ નિયમો અને શરતો યથાવત રહેશે. વધુ માહિતી માટે કૃપા કરીને વેર્સ્ટન રેલવેની મટિરીયલ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટની વે બસા ઇટ vww.wr.indianraliways.gov.in તેમજ ww.ireps.gov.in ઓક્શન પોર્ટલની મુલાકાત લો. (૬ ાા/ઓકશન પ્રોગ્રામ -૪/નવે.−૨૦૨૧ તા∶૧૧.૧૧.૨૦૨૧ **0542**

લાઇક કરો f facebook.com/West

દેવામાં આવી છે. બીજી બાજુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સહિત વિપક્ષી નેતાના નામનું કોકડું ગુંચવાયું હોવાને લઇને કોંગ્રેસ દ્વારા હજુ તૈયારીઓ પણ આરંભાઇ નથી. તાજેતરમાં ગુજરાતના રાજકારણમાં ધમાકેદાર પ્રવેશ કરનાર આપ પાર્ટીનું ગ્રામ્ય સ્તરે માળખુ પણ હજુ રચાયુ નથી. ગુજરાતના ગ્રામસ્ટ લેવલની ગ્રામ પંચાયતની આ ચૂંટણી આગામી વિધાનસભાની ચૂંટણી માટે લિટમસ ટેસ્ટ પુરવાર થઇ શકે છે.

Public Notice TO WHOMSOEVER IT MAY CONCERN

This is to inform the General Public that following share certificate of PIRAMAL ENTERPRISE LTD having its Registered Office at Piramal Ananta, Agastya Corporate Park, Opp. Fire Brigade, Kamani Junction, LBS Marg, Kurla (West), Mumbai 400070, Maharashtra, India Registered in the name of the following Shareholder/s have been lost by them.

Sr. No.	NAME OF THE SHARHOLDER	Folio No.	Certificate No	Distinctive Nos.	No. of Shares
1	VIPUL VORA	VP00291	323526	22126989- 22127038	50
2	VIPUL VORA	VP00291	323527	22127039- 22127069	25
3	VIPUL VORA	00023923	59784	209107950 - 09107958	9

with the above referred share certificates. Any person who has any claim in respect of the said share certificate/s should lodge such claim with the Company or its Registrar and Transfer Agents Link Intime India Private Limited, 247 Park, C-101, L.B.S. Marg, Vikhroli (West) Mumbai- 400083 within 15 days of publication of this notice after which no claim will be entertained and the Company shall

The Public are hereby cautioned against purchasing or dealing in any way

Place: Vadodara Date: 08-11-2021 Name of Legal Claimant.

proceed to issue Duplicate Share Certificate/s.

AXTEL INDUSTRIES LIMITED

Regd.Office: Vadodara - Halol Higway, Baska, Panchmahal , Gujarat Tel # (02676) 247140, 667900 Fax # +91(2676) 247125 E-mail: info@axtelindia.com Website:-www.axtelindia.com CIN: L91110GJ1991PLC016185

_	Extract of unaudited financial results for the	quarter ended	i Sutin Septemb	er, zuz i
				(Rs.in Lakhs
Sr.	Particulars	Three Months	Six Months	Three Months
	N	Ended 30th	Ended 30th	Ended 30th
No.		September 2021	September 2021	September 2020
		Unaudited	Audited	Unaudited
1.	a-Sales/Income from Operations	2,649.83	5069.82	4016.04
	b-Other Income	181.08	262.96	1.81
2.	Net Profit for the period (before Tax, Exceptional	301.92	518.75	722.78
	and/or Extraordinary items#)			
3.	Net Profit for the period before tax (after Exceptional	311.76	715.62	722.78
	and/or Extraordinary items#)			
4.	Net Profit for the period after tax (after Exceptional	205.96	508.18	539.84
	and/or Extraordinary items#)			
5.	Total Comprehensive Income for the period	204.18	504.62	535.78
	[Comprising Profit for the period (after tax) and			
	Other Comprehensive Income (after tax)]			
6.	Equity share capital	1,615.48	1615.48	1615.48
7.	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing			
	and discontinued operations) - Not Annualised			
	a. Basic - Rs.	1.27	3.15	3.34
	b. Diluted - Rs.	1.27	3.15	3.34
	Notoe			

The above is an extract of the detailed format of Financial Results prepared in accordance with IND-AS- as prescribed u/s 133 of the Companies Act, 2013, filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the Bombay Stock Exchange website.www.bseindia.com and company's website

For AXTEL INDUSTRIES LIMITED Ajay Parikh Place: Village Nurpura **Executive Director** Date: 12.11.2021

લેકટોસ (ઇંડિયા) લિમિટેડ

સીઆઈએનએલ ૧૫૨૦૧જીજે૧૯૯૧પીએલસી૦૧૫૧૮૬ રજી. ઑફિસઃ વિલેજ પોઈચા (રાણીયા), સાવલી, જીક્ષોઃ વડોદરા, ગુજરાતઃ ૩૯૧૭૮૦ વેબસાઈટ:www.lactoseindia.com

ઈ–મેઈલ આઈડી,: lactose@vsnl.com ટેલિફોને/ફેકસ નંઃ ૦૨૬૬૭−૨૪૪૩૦૮ ૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૧નાં રોજ પુરા થતાં ત્રૈમાસિક અને અર્ધવાર્ષિક માટેનાં અન ઓડિટેડ ફાઈનાન્સીયલ રીઝલ્ટસનો સારાંશ

						(રૂા. લાખમા)
અનુ	વિગત	પુઃ	રા થતા ત્રણ માસ્	.	પુરૂ થ	ાતું વર્ષ
નં.	ાંગળા	૩૦/૦૯/૨૦૨૧ (અનઓડીટેડ)	૩૦/૦૬/૨૦૨૧ (અનઓડીટેડ)	૩૦/૦૯/૨૦ (અનઓડીટેડ)	૩૧/૦૩/૨૦૨૧ (ઓડીટેડ)	૩૧/૦૩/૨૦૨૦ (ઓડીટેડ)
૧	વ્યવહારોમાંથી કુલ આવક (ચોખ્ખી)	૧,૦૯૫.૧૮	८६५.६७	८३८.३६	૩,૫૨૭.૬૨	8,038.80
ચ	સમયગાળા માટેનો પ્રાથમિકતાથી ચોખ્ખો નફો/ખોટ ટેકસ પહેલા, એકસેપ્શનલ તેમજ/અથવા એકસ્ટ્રાઓર્ડીનરી વસ્તુઓ)	3૬.૨૧	-૯૦.૮૫	-996.88	-૩૨७.૦૫	૯.૯૪
3	ટેકસ પહેલાના સમયગાળા માટેનો ચોખ્ખો નફો/ખોટ (એકસેપ્શનલ તેમજ/અથવા એકસ્ટ્રા ઓર્ડિનરી વસ્તુઓ પાછળ	3૬.૨૧	-૯૦.૮૫	-996.88	-૩૨૭.૦૫	૯.૯૪
8	ટેક્સ પછીનાં સમયગાળા માટેનો ચોખ્ખો નફો/ખોટ (એક્સેપ્શનલ તેમજ/અથવા એકસ્ટ્રાઓર્ડીનરી વસ્તુઓ પાછળ	3२.00	- ૬૫.૩૫	-૮૮.૨૫	-२४७.७७	૭.૨૧
પ	સમયગાળા માટેની કુલ વ્યાપક આવક (ટેકસ પછીનાં સમયગાળા માટે સમાવિષ્ટ નફો અથવા (ખોટ) તેમજ ટેકસ બાદની અન્ય સમાવિષ્ટ આવક)		- ૬૫.૩૫	-૮૮.૨૫	-२४२.२3	3.59
٤	ઈકવીટી શેર કેપિટલ(શેર દીઠ રૂા. ૧૦)	٩,٩૪૩.७٥	৭,৭४૩.७०	૧, ૦૧૮.૯०	9,983.00	१,०१८.६०
O	શેર દીઠ કમાણી (અસાધારણ વસ્તુઓ પહેલા) (રૂા. ૧૦નો શેર) (વાર્ષિક નથી) (અ) પાયાની		6.00			
	(અ) પાવાના (બ) ડાયુલીટેડ	0.२८ 0.२८	-૦.૫૭ -૦.૫૭	-0.20	-2.80 -2.80	0.00
۷	શેર દીઠ કમાણી (અસાધારણ વસ્તુઓ પછી) (રૂા. ૧૦નો શેર) (વાર્ષિક નથી)					
	(અ) પાયાની (બ) ડાયુલીટેડ	0.२८ 0.२८	-૦.૫૭ -૦.૫૭	-0.60	-2.80 -2.80	0.00

િઉપર મુજબ, ૩૦ મી સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામોના વિગતવાર બંધારણનો એક અર્ક છે જે સેબી (લિસ્ટિંગ અને અન્ય જાહેરાત આવશ્યકતાઓ) રેગ્યુલેશન, ૨૦૧૫ ના રેગ્યુલેશન ૩૩ હેઠળ સ્ટોક એક્સચેન્જમાં ફાઇલ કરવામાં આવ્યો છે. ૩૦ મી સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને અર્ધવાર્ષિક ગાળાના નાણાકીય પરિણામનું સંપૂર્ણ બંધારણ

www.bseindia.com અને www.lactoseindia.com પર ઉપલબ્ધ છે. . ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ પુરા થયેલા ત્રિમાસિક અને અર્ધવાર્ષિક ગાળાના કંપનીના ઉપરોક્ત અનઓડેટેડ નાણાકીય પરિણામોની વિંયડિટ કમિટી દ્વારા સમીક્ષા કરવામાં આવી છે અને ૧૨ નવેમ્બર, ૨૦૨૧ ના રોજ મળેલી બેઠકમાં નિયામક મંડળ દ્વારા માન્યતા પ્રાપ્ત રેકોર્ડ પર લેવામાં આવી છે

- ઉપરોક્ત પરિણામો કોર્પોરેટ અફાઇના મંત્રાલય દ્વારા સૂચિત ભારતીય એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ (ઇન્ડિયા એએસ) નું સુસંગત છે અગાઉના ત્રિમાસિક ગાળાની તુલનાત્મક નાણાકીય માહિતીને વર્તમાન ક્વાર્ટરના આંકડાને અનુરૂપ હોવાને ધ્યાનમાં લેતા ફરીથી ગોઠવવામાં / ફરીથી

સંગીતા મહેશ્વરી સ્થળ: મુંબઇ ડાયરેકટર તારીખઃ ૧૨,નવેમ્બર, ૨૦૨૧ ડીએનઃ ૦૦૨૫૫૨૦૨

MAXIMUS INTERNATIONAL LIMITED

Vadi-Wadi, Vadodara - 390003. CIN: L51900GJ2015PLC085474

EXTRACT OF STATEMENT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR

Quarter Ended Half Year Ended Year Ended **Particulars** 30.09.2021 30.06.2021 30.09.2020 30.09.2021 30.09.2020 31.03.2021 (Unaudited) (Unaudited) (Unaudited) (Unaudited) (Unaudited)

THE QUARTER AND HALF YEAR ENDED 30TH SEPTEMBER, 2021

1	lotal Income from operations (Net)	1,573.70	1,971.11	1,407.52	3,544.82	2,635.72	5,312.02	
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	134.09	116.41	162.20	250.50	249.68	395.14	
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	134.09	116.41	162.20	250.50	249.68	395.14	
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	117.68	108.57	148.20	226.25	218.57	353.22	
5	Total Comprehensive Income for the period	116.78	160.64	163.70	277.42	213.15	233.73	
6	Equity Share Capital (Face Value Rs.10/- per share)	1,257.20	1,257.20	1,257.20	1,257.20	1,257.20	1,257.20	
7	Other Equity (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	v	-	ŭ	-	864.2	
8	Earnings Per Equity Share on net profit after tax (Fully paid- up equity share of Rs. 10/- each)							
	Basic:	0.84	0.80	1.07	1.64	1.49	2.48	
	Diluted:	0.84	0.80	1.07	1.64	1.49	2.48	
	Notes: 1. Key numbers of Unaudited Standalone Financial Results							

			Standalone					
Sr. No.	Particulars	Quarter Ended			Half Year Ended		Year Ended	
	Particulars	30.09.2021	30.06.2021	30.09.2020	30.09.2021	30.09.2020	31.03.2021	
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)	
1	Turnover (Revenue from operations)	115.80	249.81	130.61	365.62	227.65	470.18	
2	Profit Before Tax	6.62	1.63	17.84	8 25	33.20	39 10	

3.62 (In above table, brackets denotes negative figures) 2. The above is an extract of the Unaudited Financial Results filed with the Stock Exchange. The detailed Financial Results are available on the

Company's website at www.maximusinternational.in and the Stock Exchange's Website at www.bseindia.com. For Maximus International Limited

Place: Vadodara

Deepak V Raval (Chairman & Managing Director)

24.02

OPTIMUS FINANCE LIMITED

Regd. Office: 504A, 5th Floor "OZONE" Dr. Vikram Sarabhai Marg, Vadi-Wadi, Vadodara - 390003. CIN: L65910GJ1991PLC015044

OPTIMUS

EXTRACT OF STATEMENT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED 30TH SEPTEMBER, 2021

		Consolidated (₹ in Lakhs)					
Sr.	Particulars	Quarter Ended			Half Year Ended		Year Ended
No.		30.09.2021	30.06.2021	30.09.2020	30.09.2021	30.09.2020	31.03.2021
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
1	Total Income from operations (Net)	1585.12	1982.81	1422.22	3567.93	2665.46	5402.33
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	131.70	114.65	161.61	246.35	248.30	399.22
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	131.70	114.65	161.61	246.35	248.30	399.22
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	115.17	106.91	147.27	222.08	216.94	355.84
5	Total Comprehensive Income for the period	114.27	158.99	162.77	273.25	211.52	236.34
6	Equity Share Capital (Face Value Rs.10/- per share)	557.23	557.23	557.23	557.23	557.23	557.23
7	Other Equity (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-		-	1085.91
8	Earnings Per Equity Share on net profit after tax (Fully paid- up equity share of Rs. 10/- each)						
	Basic:	1.16	1.12	1.52	2.28	2.11	3.60
	Diluted:	1.16	1.12	1.52	2.28	2.11	3.60

1. Key numbers of Unaudited Standalone Financial Results

ı			Standalone					
Sr.		Particulars	Quarter Ended			Half Year Ended		Year Ended
No.	No.	0.	30.09.2021	30.06.2021	30.09.2020	30.09.2021	30.09.2020	31.03.2021
			(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
1	Turnover (Revenue from operations)	11.91	11.88	15.14	23.79	30.61	90.41	
	2	Profit Before Tax	(2.39)	(1.76)	(0.60)	(4.14)	(1.38)	4.08
3		Profit After Tax	(2.50)	(1.66)	(0.95)	(4.16)	(1.63)	2.62
	/ .							

(In above table, brackets denotes negative figures) 2. The above is an extract of the Unaudited Financial Results filed with the Stock Exchange. The detailed Financial Results are available on the

Company's website at www.optimusfinance.in and the Stock Exchange's Website at www.bseindia.com. For Optimus Finance Limited

Date: 12th November, 2021 (Wholetime Director & Company Secretary)



3 Profit After Tax

Date: 12th November, 2021

The Cosmos Co-op, Bank Ltd., Pune

0.52

(Multistate Scheduled Bank)

Region II

Cosmos Bank Bhavan, Opp. Sales India, Income Tax Char Rasta, Ashram Road, Ahmedabad-380 009 Tel 079 27545693-94

Cluster Head Office: **Kothipole Branch** 7, Kothipole,

Raopura, Vadodara - 390001 Tel:0265 2422440-42

સરફેસી એકટ, ૨૦૦૨ હેઠળ સ્થાવર સુરક્ષિત મિલ્કત અને જંગમ મિલ્કતોનું ઈ-હરાજી થી વેચાણ નોટીસ

અમો, ધી કોસમોસ કો. ઓપ. બેંક લિ. ના અધિકૃત અધિકારી ઇ- હરાજી માટે ઓફર મંગાવીને અહીં ઉલ્લેખ કરેલ કસૂરવાર બાકીદારની બેન્કના કબજા વાળી સ્થાવર મિલકત તથા જંગમ મિલ્કતનું સિક્યુરિટાઈઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન એફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (સરફેસી) हેઠળ ''જે છે, જયાં છે , જે કાઈ છે અને આશ્રય વિનાના '' આધારે વેચાણ / ઇ–હારાજી કરવાનું નક્કી કરેલ છે.

<i>ө</i> і.	શાખાનું નામ, બાકીદાર, જામીનદાર તથા ગીરો કરનાર	સ્થાવર અને જંગમ મિલક્તનું વર્ણન અને માલિકનું નામ	કલમ ૧૩(૨) હેઠળ ડિમાન્ડ નોટીસની તારીખ અને બાકી લેણાં રૂા.	અનામત રકમ રૂા.	ઈએમડી (રૂા.) અને બીડ વધારવાની રકમ	નિરીક્ષણની તારીખ અને સમય તથા સંપર્ક અધિકારી
q	મે. વિક્ટરી સેલ્સ પ્રા.લી., ડાયરેક્ટરો તથા જામીનદારો ૧) શ્રી. બકુલેશ અરવિંદ સુચક ૨)શ્રીમતી શર્મિલા બકુલેશ સુચક બન્ને રહે. ૫७, ગજાનંદ સોસાયટી, માંજલપુરનાકા, વડોદરા. જામીનદારો : ૧) શ્રી કૈલાશ ચંદ્રકાંત કેમકર ૨) શ્રી વિમલ કેશવલાલ સુચક શાખા : અલ્કાપુરી	માલિક નું નામ મે. વિકટરી સેલ્સ પ્રા.લી., મિલકતનું વર્ણન : (૧) ઘનરાજ કોમ્પલેશ, વિભાગ – બી, ટીકા નંબર : ૨૨/૧ સીટી સર્વે નંબર : ૭૯, મોજે કસબા રાવપુરા, ખાદી ગ્રામોઉદ્યોગની સામે, કોઠી રોડ, રાવપુરા. વડોદરા (પાચ માળનું બીલ્ડીંગ) જેનું ક્ષેત્રફળ આશરે ૭૯૨ ચો.ફૂટ, બાંઘકામ ૩૮૧૦ ચોરસ ફુટ છે. (૨) ઇલેક્ટ્રોનિક્સ આઇટમ / હોમ એપ્લાચન્સીસ, જેવા કે ટીવી, ફ્રીઝ, વોશીંગ મશીન, ઘરઘંટી, મ્યુઝીક સીસ્ટમ વિગેરે. (પુરા જશ્થા માટે જ) ઇલેક્ટ્રોનિક્સ આઇટમ/ હોમ એપ્લાચન્સીસ નું લીસ્ટ અલકાપુરી શાખામાંથી જોવા મળશે.	નોટીસ ૧૩(૨) તા.૦૬.૧૧.૨૦૦૮ રૂા. ૨૩७.૮૩ લાખ + વ્યાજ અને ખર્ચાઓ કબજો લીધેલ તા. ૨૩.૦૧.૨૦૦૯ બાકી પડતી રકમ તા. ૩૧.૧૦.૨૦૨૧ના રોજ રૂા. ૨૪૩.૮૩ લાખ + ચડતું વ્યાજ તા, ૩૦.૦૩.૨૦૧૩ થી બાકી અને ખર્ચાઓ	શેડ્યુલ - I અનામત રકમ રૂા. ૧૨૨.૫૧ લાખ શેડ્યુલ - II અનામત રકમ રૂા. ૨.૦૫ લાખ	રૂા. ૧૨,૨૬,૦૦૦.૦૦ રૂા. ૨૧,૦૦૦.૦૦	તા.૧૩.૧૨.૨૦૨૧ સવારે ૧૧:૦૦થી બપોરે ૧:૦૦ સુધી શ્રી. હિમાંશુ શાહ મો.ઃ ૯૮७૯૫૨૫૮૫૧

ઇ-હારાજીની તારીખ ઃ તા. ૧૬.૧૨.૨૦૨૧ સ્થાવર મિલ્કત માટે સમય ઃ સવારે ૧૨ઃ૦૦ થી બપોરે ૨ઃ૦૦ સુધી જંગમ મિલ્કત માટે બપોરે ૩ઃ૦૦ થી ૪ઃ૩૦

ઈ.એમ.ડી તથા બીડ માટે છેક્ષી તારીખ : ૧૫.૧૨.૨૦૨૧

Г						
	લાભાર્થી બેંકનું નામ	ધી કોસમોસ કો.ઓપ. બેંક લી.,	લાભાર્થી બૈંકનો એકાઉન્ટ નંબર	૦ ૬૫૩७ ૦૨૧ ૯		
	શાખા	કોઠીપોળ	આઈએફએસસી કોડ	COSB0000065		

(૧) વેચાણની વિગતવાર શરતો અને નિચમો અમારી બેંકની વેબસાઇટ www.cosmosbank.com તેમજ સર્વિસ પ્રોવાઇડર ની વેબસાઇટ https://eauctions.samil.in, ઉપર ઉપલબ્ધ થઇ શકશે. ઇચ્છુક બીડરોએ ઇ–ઓકશનમાં ભાગ લેતાં પહેલાં શરતો અને નિયમો માટે આ વેબસાઇટનો અચુક સંપર્ક કરવો. (૨) હરાજી વેચાણ ઓન લાઇન ઇ–ઓક્શન / બીડીંગ મોડ દ્વારા ઉપરની તારીખ અને સમયે કરવામાં આવશે. ઇ–હરાજીમાં દરેક પાંચ મીનીટનો આપોઆપ વધારો થઇ કરશે પરંતુ વેચાણ બપોરે ૨ઃ૦૦ વાગ્ચે શેડ્યુલ–ા માટે તથા શેડ્યુલ–ાા ૪ઃ૩૦ વાગે બંધ થશે. (૩) ઇચ્છુક બીડરો ઓન લાઇન ટ્રેનીંગ સર્વિસ પ્રોવાઇડર M/s. Shree Ram Auto Mall India Ltd. સંપર્ક : શ્રી કિર્તીકુમાર ગજેરા મો. : ૯૬૨૪૦૫૬૬૦૦ હેલ્પ લાઈન e.mail:kirtikumar.g@123done.in Website :https://euctions.samil.in પાસેથી મેળવી શકશે.(૪) મિલક્ત સંબધી પૂછપરછ માટે શ્રી મીનેશ પાઠક ઓથોરાઇઝ્ડ ઓફીસર અને ચીફ મેનેજર (મો.+૯૧ ૯૩૭૪૩૯૬૦૨૨) E-mail :minesh.pathak@cosmosbank.in (૫) ઉપરોક્ત બાકીદાર / જામીનદારો / ગીરોકરનારાઓને 30 દિવસની સરફેસી કાયદાની આ નોટીસથી જાણ કરવામાં આવે છે. (૬) ઉપરોક્ત જણાવ્યા મુજબના બાકીદારે ઉપર મુજબની બાકી રકમ હરાજીની તારીખ પહેલા પુરેપુરી જમા કરાવી દેવી, જેમાં નિષ્ફળ જવાથી મિલક્તનું ઇ–હરાજી –વેચાણ કરવામાં આવશે, અને પછી કંઇપણ લેણું રહેશે તો તે બાકીદાર – જામીનદારો પાસેથી વ્યાજ સાથે વસુલ કરવામાં આવશે.

તારીખ : ૧૦.૧૧.૨૦૨૧

સ્થળ : વડોદરા

ઓથોરાઈઝ ઓફીસર અને ચીફ મેનેજર ઘી કોસમોસ કો. ઓ. બેન્ક લિ., રીઝનલ–ા

લાભાર્થી બૈંકનું નામ